

## માહે મોહરમુલ હરામ

અઝીઝો! માહે મોહરમનો ચાંદ નમુદાર થાય એ પહેલા જ ઇમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ના અઝાદારોના દીલ ગમગીન થવા લાગે છે અને ફર્શે અઝાની તૈયારી થવા લાગે છે. આ અઝાદારી અને ફર્શે અઝા આપણી હિદાયતનો, તરબીયતનો, ગુનાહ માફ થવાનો, એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની મોહબ્બતનો ઇઝહારનો અઝીમ ઝરીયો છે. પણ આ અઝાદારી અને ફર્શે અઝાના આદાબ છે. જો તેની તકેદારી રાખવામાં આવે તો આ અઝાદારીના અને ફર્શે અઝાના જરૂરી ફાયદાઓ આપણે મેળવી શકીએ.

૧) દરેક અઝાદાર મજલીસ બરપા કરે અથવા મજલીસમાં શિરકત કરે નિચ્યતને ખુલુસ કરે, ઇમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ના ગમમાં ગમગીન થવા અને એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>નો પુરસો આપવાની નિચ્યત રાખે જે જનાબે ઝહેરા<sup>(સ.અ.)</sup>ની ખુશનુદીનું કારણ બને.

૨) દરેક મોમીન બિરાદર નાના-મોટા, ગરીબ-અમીર, બધા જ ભાઈચારાની સાથે, એકતાથી અઝાદારીમાં શિરકત કરે જેથી કરીને મજલીસોનું આયોજન અને મજલીસોને બહેતર કરી શકાય.

૩) દરેક અઝાદાર જ્યારે મજલીસમાં શિરકત કરે પોતાના અપ્લાકને એવા બનાવે કે તે સાચો હુસૈની છે તે જાહેર થાય કારણ કે કરબલાની અઝીમ કુરબાનીએ ઇમામ હુસૈન<sup>(અ.સ.)</sup>એ દીને ઇસ્લામને જીવંત રાખવા, અમ્મ બિલ મઅરૂફ અને નહી અનિલ મુન્કર કરવા માટે આપી છે.

૪) દરેક એ અઝાદાર કે જે હુસૈની છે તે આ મજલીસો અને મોહરમના દિવસોમાં ધ્યાન રાખે કે ઝઘડાઓ, ફિતના-ફસાદથી પોતાને દૂર રાખે.

૫) દરેક એ જગ્યા કે જ્યાં ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની મજલીસે અઝા થાય છે ત્યાં એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup> પણ તેમાં શિરકત કરે છે તેઓને ત્યાં હાજર સમજી આ જગ્યાઓનો એહતેરામ કરીએ, નજીસ-પાકનો ખ્યાલ રાખીએ, ન્યાઝનો એહતેરામ કરીએ, મજલીસોમાં વાતો ન કરીએ, ગીબત, તોહમત વિગેરે ગુનાહાને કબીરાથી દૂર રહીએ. જેથી આપણને મજલીસનો હકીકી સવાબ હાંસિલ થાય અને ખુદા તથા એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup> આપણા પુરસાને કબૂલ કરે.

૬) દરેક મજલીસોમાં ઈમામે ઝમાના<sup>(અ.સ.)</sup>ના ઝહુરની સલામતીની દુઆ કરીએ કે અલ્લાહ ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>નો ઇન્તેકામ લેવા માટે તેની આખરી હુજ્જતનો ઝહુર કરે.

આવો! આ અઝીમ અઝાદારીની અસરો અને ફાયદાઓ જોઈએ.

## ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

તેમાં કોઈ શક નથી કે સચ્ચદુશ્મોહદા હઝરત ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની અઝાદારીની અસરો અને ફાયદાઓ અસંખ્ય છે. આવો આપણે અમૂક અસરો તરફ નજર કરીએ અને આ અઝાદારી થકી ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની કુરબત અને શફાઅતના હકદાર થઈએ:

(૧) હુસૈની કુરબાનીઓ અન્યાય અને ઝુલ્મ સામે પ્રતિક ચિન્હ છે:

તે વાત ચર્ચાને પાત્ર છે કે શા માટે એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની મજલીસો ખાસ કરીને સચ્ચદુશ્મોહદા ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની મજલીસોને ઝાલીમ ખલીફાઓ અને બાદશાહોએ રોકવાની કોશિશો કરી છે? તેનું કારણ એ છે કે ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup> અને બીજા ઈમામો<sup>(અ.મુ.સ.)</sup>ની અઝાદારી ઝાકીરો અને સ્વતંત્ર વિચારો ધરાવનારાઓ માટે જાગૃતિ લાવવાનું માધ્યમ બને છે. હઝરત ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની શહાદત અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કરની દાવત આપે છે.

બેશક આ મજલીસો કે જેમાં અખ્લાક અને અકીદાનું વર્ણન થાય છે, શ્રેષ્ઠ શાળાઓ અને યુનિવર્સિટીઓ છે જે જેહાલતને દૂર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. જેઓ આ મજલીસોમાં શિરકત કરે છે તેઓના ઈમાન અને અમલ કે જે કુરઆન અને એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>એ શીખવ્યા છે તે બતાવવામાં આવે છે.

(૨) ઈમામ<sup>(અ.સ.)</sup>ની મોહબ્બતમાં અને તેમના દુશ્મનોથી નફરતમાં વધારો:

સય્યદુશ્શોહદા<sup>(અ.સ.)</sup>ની મજલીસો થકી એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>થી મોહબ્બત અને કુરબતમાં વધારો થાય છે. તદ્ઉપરાંત ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ના મસાએબનું સતત વર્ણન કરીને ઈસ્લામ અને એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ના દુશ્મનો પ્રત્યે નફરતમાં વધારો થાય છે. અઝાદારી આપણને દરેક પ્રકારના ઝુલ્મ, અન્યાય અને ગુનાહથી દૂર રહેવાનું પ્રોત્સાહન આપે છે.

(૩) હકીકી દીનની ઓળખાણ અને તેનો પ્રચાર:

અઝાદારી અને સય્યદુશ્શોહદા<sup>(અ.સ.)</sup>ની મજલીસોની બીજી અસર એ છે કે લોકો ઈસ્લામ અને તેના સિધ્ધાંતોથી માહિતગાર થાય છે. દીને ઈસ્લામની તઅલીમાત લોકો તરફ રજુ થાય છે. મજલીસોમાં તેઓ કુરઆને કરીમ અને મોહમ્મદ વ આલે મોહમ્મદ<sup>(અ.મુ.સ.)</sup>ના અમુલ્ય શિક્ષણો જાણે અને શીખે છે.

(૪) ગુનાહોનું માફ થવું:

રચ્યાન ઈબ્ને શબીબ, ઈમામ રઝા<sup>(અ.સ.)</sup>થી વર્ણન કરે છે: ‘અય ફરઝંદે શબીબ! અગર તમે ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup> પર રડો કે તમારા આંસુ તમારા ગાલ ઉપર વહે, તો અદ્લાહ તમારા બધા ગુનાહો માફ કરી દેશે. ભલે, પછી મોટા હોય કે નાના હોય, વધારે હોય કે ઓછા.’ (મુન્તાખબ કામીલુઝઝીયારાત, પા.૧૬૪, લે.ઈબ્ને કુલવૈહ અલ કુમ્મી)



ઈમામ<sup>(અ.સ.)</sup>એ પણ ફરમાવ્યું : 'જે કોઈને રડવું હોય તે ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup> પર રડે, કારણકે આપ<sup>(અ.સ.)</sup> પર રડવાથી ગુનાહે કબીરા દૂર થઈ જાય છે.' (જીલા અલ ઉયુન, પા. ૪૬૨, લે. અદામા મજલીસી<sup>અ.ર.</sup>)

#### (૫) જન્નતમાં રહેઠાણ:

ઈમામ બાકીર<sup>(અ.સ.)</sup>એ ફરમાવ્યું: 'જે કોઈ ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ના ગમમાં આંસુ વહાવે તો અદાહ તેને જન્નતમાં જગ્યા આપશે.'

(બેહારુલ અન્વાર ૪૪/૨૯૩, લેખક: અદામા મજલીસી અ.ર.)

ઈમામ સાદિક<sup>(અ.સ.)</sup>એ ફરમાવ્યું: 'જે કોઈ ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>નો નૌહો પડે, પોતે રડે અને બીજાને રડાવે, અદાહ તે બંને માટે જન્નત વાજીબ કરી દે છે.'

#### (૬) શિક્ષા:

સચ્ચદુશ્શોહદા ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની અઝાદારીની બીજી ચમત્કારીક અસર બિમારો માટે સેહત અને લાઈલાજ રોગો માટે શિક્ષા છે.

આયતુલ્લાહ બુજર્દી<sup>(અ.ર.)</sup> વાર્ણન કરે છે કે નેવુ વર્ષની ઉમરે હું જીણાં અક્ષરો ચશ્મા વગર વાંચી શકું છું. આંખની આ રોશની માટે હું સચ્ચદુશ્શોહદા ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>નો આભારી છું. અમૂક વર્ષો પહેલા હું બુજર્દમાં હતો જ્યાં મને આંખનો સપ્ત દુખાવો શરૂ થયો. તબીબોએ દવા દીધી પરંતુ દવાઓએ કાંઈ અસર ન કરી. પછી મોહર્રમ શરૂ થયો.

આયતુલ્લાહ મોહર્રમના પહેલા દસ દિવસ બુજર્દમાં આવ્યા અને ઘણી બધી મજલીસોમાં શિરકત કરી. આશુરાના દિવસે ઘણા બધા લોકો માતમી જુલુસ લઈને આવતા. જેમાં સાદાત, આલીમો

અને મોઝમીનો હાજર હતા. દરેક કમરમાં સફેદ કપડું અને માથામાં ધૂળ નાંખી માતમ કરતા અને નૌહા પડતા પસાર થતા હતા. આયતુલ્લાહ<sup>(અ.ર.)</sup> વાર્ણન કરે છે:

જ્યારે તેઓ મારા ઘરમાં આવ્યા અને મજલીસ કરી તો મારી અજીબ હાલત થઈ. હું ખુશામાં બેસી ધીમે ધીમે રડતો હતો. પછી મેં જુલુસના લોકોના કદમોની ધૂળ ઉપાડી અને મારી દુઃખતી આંખો ઉપર લગાડી. અઝાદારોના પગની ધૂળે મારી આંખોને એવી શિફા આપી કે આજ સુધી ક્યારેય મને આંખનો દુઃખાવો થયો નથી. એટલું જ નહિં પરંતુ મારી આંખોની રોશની પણ તેજ થઈ ગઈ અને ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ના સદકારી ચશ્મા પહેરવાની પણ જરૂર પડતી નથી.

(૭) જે ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup> પર રડે તે ક્યામતના દિવસે નહિં રડે:

હઝરત રસૂલેખુદા<sup>(સ.અ.વ.)</sup>એ જનાબે ફાતેમા ઝહુરા<sup>(સ.અ.)</sup>ને ફરમાવ્યું: 'તમામ આંખો ક્યામતના દિવસે રડશે સિવાય તે આંખો કે જે ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની મુસીબતો પર રડી હોય. તેઓ હસતી હશે અને જન્નતની નેઅમતોથી ખુશ હશે.'

(ઈખ્તેયાદે મઅરેફત, અલ રેજાલ, પાના નં. ૮૯, શૈખ તુસી)

(૮) મૌતના સમયની મુશ્કેલીઓથી રક્ષણ:

જે કોઈ ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup> પર રડે તો મલેકુલ મૌત તેના માટે તેની મૌતના સમયે માં કરતા પણ વધારે મહેરબાન રહેશે.

(ખુલાસા અઝ મકાલએ આશુરા, લે. જવાદ મોહદેસી)

આવો! આપણે અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ કરીએ કે તે આપણને સચ્ચદુશ્શોહદા ઈમામ હુસૈન<sup>(અ.સ.)</sup>ની વધારેમાં વધારે અઝાદારી કરવાની તૌફીક અતા કરે.